



બ્રેમ્પટન ટ્રાન્ઝિટ નવો PRESTO લોયલ્ટી પ્રોગ્રામ (વફાદારી કાર્યક્રમ) શરૂ કર્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 3, 2020) – સોમવાર, જુલાઈ 6 નાં રોજ, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એક લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે જેનાથી ગ્રાહકો પોતાના PRESTO કાર્ડ વડે ભાડું ચૂકવે ત્યારે તેઓ મફત રાઈડ્સ કમાય છે.

ઉતારુઓ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પર સોમવારથી રવિવાર સુધીના એક-અઠવાડિયાના સમયગાળામાં પોતાના PRESTO કાર્ડના બેલેન્સમાંથી (જમા સિલકમાંથી) 12 ટ્રિપ્સ માટે ચૂકવણી કરે ત્યારે, તે જ અઠવાડિયા પૂરતી ત્યાર પછીની બધી ટ્રિપ મફત રહે છે.

લોયલ્ટી પ્રોગ્રામ નવો છે અને સંપર્કરહિત ચૂકવણીઓ કરવા પ્રોત્સાહિત કરીને, ઉતારુઓ માટે પ્રવાસ કરવા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ફાયદાકારક બને છે. બધાં ઉતારુઓ પોતાની ઉંમર ભલે ગમે તે હોય તો પણ મફત ટ્રિપ્સ કમાઈ શકે છે, કારણ કે કાર્યક્રમ બધી ભાડા શ્રેણીઓને લાગુ પડે છે. તબદીલીઓ અને અન્ય ટ્રાન્ઝિટ સેવા પૂરી પાડનારાઓ અને ડિસ્કાઉન્ટ મેળવેલું GO કો-ફેર (સહિયારું ભાડું) ચૂકવેલું ભાડું આ પ્રોગ્રામમાં ગણતરીમાં લેવાનું નથી. અઠવાડિક પાસીસ હજુ પણ ઉપલબ્ધ છે.

પોતાની ટ્રિપ્સ માટે ચૂકવણી કરવા હજુ પણ રોકડ રકમનો ઉપયોગ કરતા ઉતારુઓને કસ્ટમર સર્વિસ કાઉન્ટર પરથી PRESTO કાર્ડ મેળવી લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. માત્ર સીમિત સમય માટે, \$6 ની PRESTO કાર્ડ ફી માફ કરવામાં આવી છે – ગ્રાહક દીઠ એક કાર્ડ. ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ પર કસ્ટમર કાઉન્ટર્સ, ટ્રિનિટી કોમન ટર્મિનલ બિલ્ડિંગના અપવાદ સાથે, ખુલ્લા છે.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માર્ક પહેર્યો હોય તો પણ, ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવા વિનંતી કરે છે. ઉતારુઓને મુસાફરી કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાર્થટ પર પરીક્ષણ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્ક્સ પહેરવા અનિવાર્ય બને છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ

www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडाल्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca